

# જામનગર મહાનગરપાલિકા

## જામનગર



:: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ::

ઈ. ટેન્ડર નં.જેએમસી/સો.વે./૩૮/ટેન્ડર નિવિદા/૧૫૮/૨૦૨૬-૨૭.

૧	કામનું નામ :	સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ધ્વારા મ.ન.પા હસ્તકના સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત જુદા જુદા જાહેર લોકેશનોની હાઉસ કીપીંગ (સફાઈ) કામગીરીના વાર્ષિક કામો માટે તેમજ સિવિલ વર્ક મેન પાવર વર્ક અને મશીન વર્ક માટેનું કામ.
૨	કામની અંદાજીત રકમ :	રૂ.૨.૮૫ કરોડ
૩	અનેસ્ટમની ડીપોઝીટ :	રૂ.૨,૮૫,૦૦૦/-
૪	શ્રેણી (ક્લાસ)	"બી" તથા ઉપરના
૫	ટેન્ડર ફી :	રૂ.૩૬૦૦/- (નોન રીફંડેબલ)
૬	સિક્યોરીટી ડીપોઝીટ :	ટેન્ડર રકમના ૫% લેખે
૭	ઓન લાઈન ટેન્ડર ડાઉનલોડ શરૂ તારીખ/સમય :	તા.૧૧/૦૬/૨૦૨૬ સવારના ૧૧-૦૦ કલાકથી
૮	ઓન લાઈન ટેન્ડર રજુ કરવાની છેલ્લી તારીખ/સમય :	તા.૦૧/૦૭/૨૦૨૬ સાંજના ૬-૦૦ કલાક સુધી
૯	ટેન્ડર ડોક્યુમેન્ટ આપવાની તારીખ/સમય :	તા.૦૩/૦૭/૨૦૨૬ સુધી ઓફિસ અવર્સ દરમિયાન, ૩જો માળ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, મહાનગરપાલિકા, જામનગર.
૧૦	ટેન્ડર ખોલવાની તારીખ/સમય :	તા.૦૬/૦૭/૨૦૨૬ બપોર બાદના ૪-૦૦ કલાકે
૧૧	ટેન્ડર વેલીડિટી પિરીયડ :	૧૮૦ દિવસ

## ટેન્ડરની યોગ્યતા

આ ટેન્ડર અંગેની વધુ માહિતી નીચે મુજબ છે.

૧.૦	<b>કામનું નામ :</b> સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ધ્વારા મ.ન.પા હસ્તકના સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત જુદા જુદા જાહેર લોકેશનોની હાઉસ કીપીંગ (સફાઈ) કામગીરીના વાર્ષિક કામો માટે તેમજ સિવિલ વર્ક મેન પાવર વર્ક અને મશીન વર્ક માટેનું કામ.
૨.૦	<b>ટેન્ડર ડાઉન લોડીંગની વિગતો :</b>
૨.૧	ટેન્ડર ડોક્યુમેન્ટ નિયત તારીખ/સમય સુધીમાં વેબ સાઈટ <a href="https://jmctender.nprocure.com">https://jmctender.nprocure.com</a> ઉપરથી ઉપલબ્ધ થઈ શકશે.
૨.૨	જે પાર્ટી ટેન્ડરમાં ભાગ લેવા માંગતી હોય તેઓ વેબ સાઈટ <a href="https://jmctender.nprocure.com">https://jmctender.nprocure.com</a> માં રજીસ્ટર થયેલ હોવા જોઈશે.
૩.૦	<b>ડીઝીટલ સર્ટીફિકેટ</b>
૩.૧	જે પાર્ટી ઓનલાઈન ટેન્ડરમાં ભાગ લેવા માંગતી હોઈ તેઓની પાસે કાનુન માન્ય ડીઝીટલ સર્ટીફિકેટ (ક્લાસ-iii) ઈન્ફોર્મેશન ટેકનોલોજી સર્ટીફાઈંગ ઓથોરીટીનું હોવું જરૂરી છે. ભારત સરકાર માન્ય લાયસન્સ સર્ટીફાઈંગ ઓથોરીટી (એન) કોડ સોલ્યુશન્સ એ ડીવીઝન ઓફ જી.એન.એફ.સી. લીમીટેડ પાસેથી ડીઝીટલ સર્ટીફિકેટ મેળવવાનું રહેશે.
૩.૨	તમામ ભાવો ડીઝીટલ સાઈન થયેલા હોવા જોઈશે. ડીઝીટલ સીગ્નેચર સર્ટીફિકેટ તેમજ સંબંધિત જાણકારી માટે નીચે મુજબના સરનામા ઉપર સંપર્ક કરી શકાશે. <b>(એન) કોડ સોલ્યુશન્સ</b> "એ" ડીવીઝન ઓફ જીએનએફસી લીમીટેડ, ૩૦૧, જી.એન.એફ.સી., ઈન્ફો. ટાવર, બોડાક દેવ, અમદાવાદ-૩૮૦૦૫૪ (ભારત) ટેલિફોન નંબર : ૮૧ ૨૬૮૫૫૭૩૧૬/૧૭/૧૮ ફેક્સ : ૮૧ ૭૮ ૨૬૮૫૭૩૨૧
૩.૩	જે પાર્ટીઓ માન્ય ડીઝીટલ સર્ટીફિકેટ ધરાવતા હોઈ તેઓને નવા ડીઝીટલ સર્ટીફિકેટની જરૂરીયાત રહેશે નહીં.
૪.૦	<b>ઓન લાઈન ભાવો રજુ કરવા અંગે</b>
૪.૧	રસ ધરાવતી પાર્ટી, ટેન્ડર રજુ કરવાની નિયત તારીખ અને સમય સુધીમાં ભરેલ ભાવોમાં સુધારા વધારા કરી શકશે. ટેન્ડર રજુ કરવાની નિયત તારીખ/સમય બાદ કોઈ પણ સુધારા વધારા કરી શકાશે નહીં. આ બાબતે કોઈ લેખિત કે ઓન લાઈન વિનંતી મંજૂર કરવામાં આવશે નહીં.
૪.૨	ભાવો ફક્ત ઈલેક્ટ્રોનિક્સ ફોર્મેટમાં ઉપર દર્શાવ્યા મુજબની વેબ સાઈટ ઉપર નિયત તારીખ સમય સુધીમાં ડીઝીટલ સાઈનથી જ આપવાના રહેશે.
૪.૩	ડીઝીટલ સાઈન વિનાના ભાવો સ્વીકારવામાં આવશે નહીં.
૪.૪	કોઈપણ સંજોગોમાં ભૌતિક પત્રક સ્વરૂપમાં ભાવો સ્વીકારવામાં આવશે નહીં.
૫.૦	<b>ટેન્ડર ફી, ઈ.એમ.ડી. તથા અન્ય દસ્તાવેજ રજુ કરવા અંગે.</b>
૫.૧	ટેન્ડર ફી રૂ.૩૬૦૦/- (રૂપિયા ત્રણ હજાર છસો પુરા) રોકડેથી મ્યુનિ. તિજોરીમાં અથવા કમિશનરશ્રી જામનગર મહાનગરપાલિકાના નામે કોન્ટ્રાક્ટરે મહાનગરપાલિકાની તરફેણમાં રાષ્ટ્રીયકૃત બેંક / શેડ્યુલ્ડ બેંકના ડીમાન્ડ ડ્રાફ્ટથી પેયેબલ એટ કોન્ટ્રાક્ટરેનો ભાવો સાથે રજુ કરવાના રહેશે, જે નિયત તારીખ બાદ રજુ કર્યે સ્વીકારવામાં આવશે નહીં.
૫.૨	અર્નેસ્ટમની ડીપોઝીટ રૂ.૨,૮૫,૦૦૦/- (રૂપિયા બે લાખ પંચાશુ હજાર પુરા) ડીમાન્ડ ડ્રાફ્ટ/ એફ.ડી.આર.થી કમિશનરશ્રી જામનગર મહાનગરપાલિકાના નામે, કોન્ટ્રાક્ટરે મહાનગરપાલિકા, પેયેબલ એટ કોન્ટ્રાક્ટરે, રાષ્ટ્રીયકૃત બેંક/ શેડ્યુલ્ડ બેંકનો રજુ કરવાનો રહેશે. જે નિયત તારીખ બાદ સ્વીકારવામાં આવશે નહીં.

પ.૩	અન્ય જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ / કુરીયર મારફત નિયત સમય મર્યાદામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં પહોંચતા કરવાના રહેશે.
પ.૪	રસ ધરાવતી પાર્ટીઓએ ટેન્ડર ફી, ડીમાન્ડ ડ્રાફ્ટ તથા દસ્તાવેજો ઉપર જણાવેલ વિગતે ભૌતિક સ્વરૂપે નિયત તારીખ અને સમય સુધીમાં સોલિડ વેસ્ટ શાખા, મહાનગરપાલિકા, કોન્ટ્રાક્ટરેમાં રજુ કરવાના રહેશે. જે નિયત તારીખ બાદ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તથા આવા ભાવો સ્વીકૃતીને પાત્ર થશે નહીં.
પ.૫	પાર્ટીઓને બિનશરતી ભાવો ટેન્ડરની શરતો મુજબ આપવાના રહે છે.
દ.૦	<b>ટેન્ડર ખોલવા અંગે</b>
દ.૧	આવેલ ભાવો નિયત તારીખ/સમય એ કોમ્પ્યુટર શાખા, ચોથો માળ, મહાનગર સેવા સદન, કોન્ટ્રાક્ટરે ખાતે ખોલવામાં આવશે.
દ.૨	ભાવ ભરનાર પાર્ટી કે તેના પ્રતિનિધિ હાજર રહેવા માંગતા હોઈ તો ઉપર જણાવેલ તારીખ/ સમય તથા સ્થળે હાજર રહી શકશે.

**Jamnagar Municipal Corporation**  
**Jamnagar**  
**Solid Waste Management Department**

**Name of Work :** Supply of manpower, machinery (bac hoe loader, tractor with trolly, excavator, dumper) and civil work under Swatchh saher, Sunder Saher at various location of JMC

**Details Filled by Agencies**

- 1 Name of Agencies :
- 2 Office Address :
- 3 Phone Number :
- 4 Registration :
- 5 Income Tax Details
- 6 Solvency Certificate :  
(Of current year of min.  
Rs.59 Lacs)
- 7 Details of E.M.D. :

I /We hereby by declare that I/we have carefully Study the condition of  
Tender documents of this work and agree for execute the same accordingly.

Place :

Date :

**Contractor/Agencies Signature**

# Jamnagar Municipal Corporation

## Jamnagar

### Solid Waste Management Department

**Name of Work :** Supply of manpower, machinery (back hoe loader, tractor with trolley, excavator, dumper) and civil work under Swachh saher, Sunder Saher at various location of JMC

:: Schedule "B" ::

<b>Sr. No.</b>	<b>Particulars</b>	<b>Unit</b>	<b>Amount</b>
<b>A</b>	Saher Swachhta (City Cleanliness) (Man power, Tractor with trolley including supervision)	Year	<b>Rs.2,14,03,600</b>
<b>B</b>	City Beautification (Back hoe loader, tractor, with trolley, excavator, dumper including supervision)	Year	<b>Rs.32,83,500</b>
<b>C</b>	A+B + <b>5% Contractor's profit</b>	Year	<b>Rs.12,34,355</b>
	Total		<b>Rs.2,59,21,455</b>
	say	Year	<b>Rs.2,60,00,000</b>
<b>D</b>	Wall Painting	Year	<b>Rs.10,00,000</b>
<b>E</b>	<b>Beautification Civil Work</b>	Year	<b>Rs.25,00,000</b>
<b>Total</b>			<b>Rs. 2,95,00,000</b>

I/We am/are willing to carry out above work at .....% above /below.  
In word .....percentage above/below the tender rate,  
which mentioned above.

Place :

Date :

**Signature of Contractor  
and Seal**

**Executive Engineer  
Solid Waste Management  
Jamnagar Municipal Corporation**

## જામનગર મહાનગરપાલિકા

### જામનગર

**કામનું નામ :** સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ધ્વારા મ.ન.પા હસ્તકના સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત જુદા જુદા જાહેર લોકેશનોની હાઉસ કીપીંગ (સફાઈ) કામગીરીના વાર્ષિક કામો માટે તેમજ સિવિલ વર્ક મેન પાવર વર્ક અને મશીન વર્ક માટેનું કામ.

#### (A) મેન પાવર માટેની શરતો :

- (૧) સફાઈનો દૈનિક સમય સવારે ૭-૦૦ થી ૧૧-૦૦ કલાક તેમજ બપોરે ૩-૦૦ થી ૭-૦૦ કલાકનો રહેશે.
- (૨) સુચના મુજબના ડસ્ટબીન દિવસમાં બે વખત સફાઈ કરવાના રહેશે.
- (૩) ઉડતો કચરો/પ્લાસ્ટિક સફાઈ કામગીરીના સમયગાળા દરમિયાન સતત વીણવાનું રહેશે.
- (૪) વી.આઈ.પી. રૂટ તેમજ ઈમરજન્સી / જરૂરીયાત મુજબનું આયોજન કરવામાં આવેલ હોય (રાત્રી / દિવસ) તે દરમિયાન જરૂરીયાત મુજબના કામદારો હાજર રાખવાના રહેશે. જેનો કોઈ અલગથી ચાર્જ ચુકવવામાં આવશે નહીં.
- (૫) સ્વચ્છતા અભિયાન અન્વયે તેમજ સર્વેક્ષણ સમયે વધારાની કામગીરી માટે જરૂરીયાત મુજબની વધારાની સફાઈ કરાવવાની રહેશે.
- (૬) રજા/ ગેરહાજર ઉપર ગયેલ કામદારની ગેરહાજરીમાં અન્ય કામદારની વ્યવસ્થા કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

#### સાધન સામગ્રી :

- (૧) સાવરણી, સાવરણા, ઉભા-ઝાડુ, પોતા, એસીડ, ફીનાઈલ, વાઈપર, મિકેનિકલ બ્રુશ, વેક્યુમ કલીનર્સ, એર રીફિશનર
- (૨) સલામતિના સાધનો (સેફ્ટી ઈક્વીપમેન્ટ) જરૂરીયાત મુજબ
- (૩) પાવડો, તગારા, ખપારી તથા સફાઈ લગત અન્ય સાધન સામગ્રી વિગેરે

#### લોકેશન વાઈઝ ન્યુનતમ રાખવાના થતા લેબર :

શેડ્યુલ "બી" માં દર્શાવ્યા મુજબ તેમજ કંટ્રોલીંગ ઓફિસરશ્રી, નાયબ ઈજનેરશ્રી, લગત ઈજનેરશ્રી, ઝોનલ ઓફિસરશ્રી, એસ.આઈ.શ્રી, એસ.એસ.આઈ.શ્રી ધ્વારા સુચવે તેમજ જરૂરીયાત મુજબ વધારાના લેબર મુકી કામગીરી કરાવવાની રહેશે. સદરહું કામ અન્વયે જરૂરીયાત મુજબના સુપરવાઈઝર રાખવાના રહેશે.

#### કામની સામાન્ય શરતો :

- (૧) ટેન્ડર ભરનારે ટેન્ડરમાં સરકારશ્રીના પ્રવર્તમાન અને આ કામગીરી કોન્ટ્રાક્ટને લાગુ થતા તમામ પ્રકારના ટેક્સ સાથેના ભાવ આપવાના રહેશે. ટેક્સનું હાલનું કર-દરના ચાર્જ /ટકાવારીનો ઉલ્લેખ કરવાનો રહેશે.
- (૨) કોન્ટ્રાક્ટ ની સમયમર્યાદા કામ શરૂ થયાની વર્ક ઓર્ડર તારીખથી ૧(એક) વર્ષની રહેશે.
- (૩) લોએસ્ટ પાર્ટી નક્કી થઈ આવ્યે જે તે દિવસથી લોએસ્ટ પાર્ટીએ ધોરણસરના કરારખત (એગ્રીમેન્ટ) અંદાજીત કોન્ટ્રાક્ટ વેલ્યુના ૫% સિક્યુરીટી ડીપોઝીટ જમા કરાવ્યા સહિતની કાર્યવાહી દિન-૩૦ માં બિનચૂક પૂર્ણ કરવાની રહેશે. જેના ડીફોલ્ટના કિસ્સામાં ઈ.એમ.ડી જપ્ત કરી જે તે કોન્ટ્રાક્ટરને જામનગર મહાનગરપાલિકાના કોઈપણ કોન્ટ્રાક્ટ વર્ક કે કામગીરી માટે ૩ વર્ષ સુધી ડીસ્ક્વોલીફાઈ કરી "કાળી યાદી" માં મુકવામાં આવશે. સરકારશ્રીના વખતો વખતના નિયમ મુજબ આઈ.ટી. બીલમાંથી કપાત કરવામાં આવશે. તથા સરકારશ્રી ધ્વારા જે કંઈ ટેક્સ કે વેરા નાખવામાં આવે તે બીલમાંથી કપાત કરવામાં આવશે.

- (૪) કોન્ટ્રાક્ટરે ટેન્ડર રકમના ૫% લેખે પફોર્મન્સ બોન્ડ તરીકે બેંક ગેરેન્ટી રજુ કરવાની રહેશે.
- (૫) રાજ્ય સરકારના નક્કી થયેલા ચાર્જ કે વખતોવખત લાગુ પડતા જે તે કાયદા હેઠળ નક્કી થતા ચાર્જ કે સરકારી/અર્ધ સરકારી ટેક્સ / ચાર્જ / ફી /વેરા આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટર રહેશે. ઉપરોક્ત કોન્ટ્રાક્ટરની મુદત પુરી થયા બાદ પણ જો સરકારશ્રી તરફથી લેણું નીકળતુ હશે તો જામનગર મહાનગરપાલિકા ઈજારદાર પાસેથી તેવુ લેણુ લેવા હકકદાર રહેશે.
- (૬) આ કામગીરી દરમ્યાન કોન્ટ્રાક્ટરના સાધનો કે માણસો ધ્વારા કોન્ટ્રાક્ટરશ્રીના માણસો કે રાહદારીને કોઈપણ અકસ્માત થાય કે મૃત્યુ થાય તેની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે. તેમાં મ.ન.પા. ની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહીં.
- (૭) કોઈપણ સંજોગોમાં કોન્ટ્રાક્ટરશ્રી ધ્વારા કોન્ટ્રાક્ટની મુદત પુરી થતા પહેલા કામ અધુરુ મુકવામાં આવશે તો સીક્યોરીટી ડીપોઝીટ જપ્ત કરી, મહાનગરપાલિકાનાં કોઈપણ કામ માટે કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે.
- (૮) બીલનું પેમેન્ટ બે માસ અથવા અનિવાર્ય સંજોગોમાં મ.ન.પા.ની કન્ડીશન મુજબ નિયમ અનુસાર કરવામાં આવશે. તેમજ સફાઈ થયા અંગે થયેલ કામગીરીનો રીપોર્ટ લગત ઝોનલ ઓફિસર, એસ.આઈ. એસ.એસ.આઈ. પાસેથી મેળવી બીલ સાથે જોડવાના રહેશે. તેમજ કામદારોના ઈ.એસ.આઈ.સી., ઈ.પી.એફ. ભરપાઈ કર્યા અંગેના આધાર બીલ સાથે રજુ કરવાના રહેશે.
- (૯) આવેલ ભાવ પૈકી કોઈપણ ભાવ મંજુર/નામંજુર કરવાનો મ.ન.પા.નો હકક અબાધીત રહેશે.
- (૧૦) કોન્ટ્રાક્ટરે કામદારોની ઓળખ માટે "યુનિફોર્મ" તથા "આઈડન્ટી કાર્ડ" ઈશ્યુ કરવાના રહેશે.
- (૧૧) કોન્ટ્રાક્ટ દરમ્યાન રાખવામાં આવેલ કામદારોના ઈ.એસ.આઈ.સી., ઈ.પી.એફ. તથા લેબર લાયસન્સ વિગેરે જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
- (૧૨) કોન્ટ્રાક્ટર ધ્વારા જે વ્યક્તિઓને આ કામ માટે રોકવામાં આવી હોય, તેઓને કોઈપણ સંજોગોમાં લઘુત્તમ વેતનથી ઓછો પગાર આપી શકાશે નહિ અને સરકારશ્રી ધ્વારા વખતોવખત જે વેતન સુધારો કરવામાં આવે તે મુજબ વેતન ચૂકવવાનું રહેશે. આ અંગેની કોઈપણ પ્રકારની કાયદાકીય તકરાર ઉભી થશે તે બાબતેની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. આ કામે રાખેલ કામદારો પુખ્તવયના હોવા જરૂરી છે.
- (૧૩) કોન્ટ્રાક્ટરે દરેક લોકેશન સફાઈ કામદારોનું હાજરી રજીસ્ટર નિભાવવાનું રહેશે. દૈનિક ધોરણે હાજર ગેરહાજર સફાઈ કર્મચારીઓની હાજરી લગત વોર્ડના એસ.એસ.આઈ. / એસ.આઈ / ઝોનલ ઓફિસર પાસે વેરીફાઈ કરાવવાની રહેશે.
- (૧૪) કોન્ટ્રાક્ટરએ હાઉસ કીપીંગ સફાઈની કામગીરી માટે ૧૮ વર્ષથી ઉપરની વયના ૪૫ વર્ષ વય સુધીની કામદારો રાખવાના રહેશે. કોઈપણ સંજોગોમાં બાળ કામદારો તથા વૃધ્ધો, અશક્ત, અપંગ કે ચેપી રોગથી પીડાતી વ્યક્તિને કામે રાખી શકાશે નહીં. કોન્ટ્રાક્ટર ધ્વારા જામનગર મહાનગરપાલિકાના પે-રોલ પરનો કોઈપણ કર્મચારીને આ કામગીરીમાં ઉપયોગમાં લેવાના રહેશે નહીં. જો આવો કોઈપણ કર્મચારી આ કામગીરી ઉપયોગમાં લેતા માલુમ પડશે તો પ્રતિદિન રૂ.૫૦૦૦/- ની પેનલ્ટી કરવામાં આવશે અને બીજી વખત જો માલુમ પડશે તો કોન્ટ્રાક્ટ રદ થવાને પાત્ર રહેશે.

- (૧૫) કોન્ટ્રાક્ટર તરફથી જે કામદારો કામ અંગે રોકવામાં આવે તે કામદારોના પગાર, ભથ્થા, રજા વિગેરે કોઈપણ હકક માટે મહાનગરપાલિકાની કોઈપણ જવાબદારી રહેશે નહિ. તેમજ તેઓ મહાનગરપાલિકાના કર્મચારીઓ કોઈપણ રીતે ગણાશે નહિ.
- (૧૬) આવેલ ટેન્ડર/તમામ ટેન્ડરો મંજૂર કે નામંજૂર કરવાનો હકક સક્ષમ સત્તાને અબાધિત રહેશે, જે અંગે કોઈપણ જાતના કારણો આપવામાં આવશે નહિ.
- (૧૭) આ કામગીરીના સુપરવિઝન માટે જરૂરી સુપરવાઈઝર કોન્ટ્રાક્ટશ્રીએ રાખવાનો રહેશે અને સુપરવાઈઝર પાસે મોબાઈલ ફોન હોવો જરૂરી છે.
- (૧૮) આ કામની ટેન્ડરની શરતોમાં જરૂરી જણાયેથી ફેરફાર કરવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અધિકૃત રહેશે. જે ફેરફાર કોન્ટ્રાક્ટરને મંજૂર તેમજ બંધનકર્તા રહેશે.
- (૧૯) કોન્ટ્રાક્ટરની કામગીરી સંતોષકારક નહીં લાગે તથા નિયમિત સાફ સફાઈ નહીં કરવામાં આવે અથવા કોન્ટ્રાક્ટરે અધિકૃત અધિકારીની સુચનાઓનું યોગ્ય પાલન નહીં કરતા હોવાનું જણાશે અથવા તો કામ નિયત સમયમાં પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેવા કિસ્સામાં કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે આ કામ મહાનગરપાલિકાને યોગ્ય લાગે તે કોન્ટ્રાક્ટર પાસે પૂર્ણ કરાવવામાં આવશે અને આ થયેલ કામગીરીનું પેમેન્ટ કોન્ટ્રાક્ટરના બીલમાંથી વસુલ લેવામાં આવશે. તેમજ કોન્ટ્રાક્ટરની સિક્યોરીટી ડીપોઝીટ જપ્ત કરી, જામનગર મહાનગરપાલિકાના અન્ય કામો માટે પણ કોન્ટ્રાક્ટરને ગેરલાયક ઠરાવવામાં આવશે. તેમજ સક્ષમ સત્તાનો નિર્ણય આપરી ગણાશે.
- (૨૦) સાફ-સફાઈની કામગીરી દરમિયાન સંસ્થાના માલ-સામાનને કોઈપણ જાતનું નુકશાન નહિ થાય તેની કાળજી રાખવાની રહેશે. તેમ છતાં જો નુકશાન થશે અથવા માલ-સામાન ગુમ થશે તો માલની પુરેપુરી કિંમત કોન્ટ્રાક્ટરના બીલમાંથી વસુલ કરવામાં આવશે.
- (૨૧) કોન્ટ્રાક્ટરે ઓફર આપતા પહેલા હાઉસ કીપીંગ/સફાઈ અંગેની જગ્યા તથા હદ વિસ્તાર પુરેપુરો જોયો હોવાનું માની લેવામાં આવશે.
- (૨૨) સાફ-સફાઈથી એકત્રીત થયેલો કચરો કોન્ટ્રાક્ટર ધ્વારા યોગ્ય વ્યવસ્થા કરી નિયત થયેલ જગ્યાએ મ્યુનિ. કચરાપેટીમાં અથવા સુચવવામાં આવે ત્યાં સ્વખર્ચે નિકાલ કરવાનો રહેશે.
- (૨૩) જામનગર મહાનગરપાલિકા ધ્વારા સર્વેક્ષણ સમય તેમજ વી.આઈ.પી. રૂટ તેમજ અન્ય જરૂરીયાત હોય ત્યારે હાઉસ કીપીંગને લગતી વધારાની કામગીરી આ કામના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે તો તે વિના મુલ્યે કરી આપવાની રહેશે.
- (૨૪) કોન્ટ્રાક્ટરે હાઉસ કીપીંગ કોન્ટ્રાક્ટ કામગીરી માટે સવારે-બપોર અને જરૂરીયાત હોય તો જણાવવામાં આવે તેવા સમયે પુરતી સાધન, સામગ્રી, મેનપાવર્સ/ મિકેનિકલ ઈકવીપમેન્ટસ (જો જરૂર હોય તો) સાથેની કરવાની રહેશે અને આવી કામગીરી ઓછામાં ઓછા સમયગાળા દરમિયાન અસરકારક રીતે સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવીને સંતોષકારક પૂર્ણ કરવાની રહેશે.
- (૨૫) વર્ક ઓર્ડરમાં સુચવ્યા મુજબની તારીખથી કામગીરી શરૂ કરવાની રહેશે. આ કામની સમય મર્યાદા એક વર્ષની રહેશે. વધુ ત્રણ માસ માટે આ કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે અને ત્યાં સુધી કોન્ટ્રાક્ટ ચાલુ રાખવાનો રહેશે. તે માટે કોન્ટ્રાક્ટર પોતાની રીતે કોઈ અલગથી ભાવ વધારો કે વધારાની શરતોનો સમાવેશ કરી શકશે નહીં.

- (૨૬) કોન્ટ્રાક્ટરે આ કામગીરી લોકોના આરોગ્ય અને સુખાકારીના હિતમાં આવશ્યક અને ફરજીયાત હોય, ૩૬૫ દિવસ સફાઈ કામદારો પાસે લેવાની રહેશે.
- (૨૭) ચોમાસાની ઋતુ કે કુદરતી આફતના સમયે જરૂરી રેઈન કોર્ટ તથા ટોર્ચ તથા શિયાળાની ઋતુમાં કામદારોને જરૂરી ગરમ કપડાની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે પોતાના સ્વખર્ચે કરવાની રહેશે.
- (૨૮) ઉક્ત કામ દરમ્યાન કોઈપણ અકસ્માત કે જાનહાનિ જેવા અનિચ્છનીય બનાવ બનવા પામે, તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઠેકેદારની રહેશે. આવા બનાવો અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના બ્રાંચ અધિકારીશ્રી, જામનગર મહાનગરપાલિકા, જામનગરને ત્વરિત લેખિત જાણ કરવાની રહેશે. ઉક્ત બાબતે મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં.
- (૨૯) બીલનું પેમેન્ટ બે માસ અથવા અનિવાર્ય સંજોગોમાં મ.ન.પા.ની કન્ડીશન મુજબ નિયમ અનુસાર કરવામાં આવશે. કામગીરીનું બીલ કોન્ટ્રાક્ટર ધ્વારા પગારબીલ રજુ કર્યા બાદ મીનીમ વેજીસની ચકાસણી કર્યા બાદ બીલની ચુકવણી કરવામાં આવશે અને પેમેન્ટ કોઈપણ પ્રકારનું ડીલે થાય તો કોન્ટ્રાક્ટર કોઈપણ પ્રકારનું વળતર કે અન્ય રીતે વ્યાજ વિગેરેની માંગણી કરી શકશે નહીં.
- (૩૦) લેબર લો એક્ટની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે. જ્યારે કોઈ અકસ્માત થાય તો વર્કમેન કોમ્પેસેશન એક્ટ મુજબ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
- (૩૧) આ કામના પેટા કોન્ટ્રાક્ટ આપી શકાશે નહીં.
- (૩૨) કોન્ટ્રાક્ટર ધ્વારા રાખવામાં સફાઈ કામદારોનું મહાનગરપાલિકા સુચવે તે મુજબ હેલ્થ ચેકઅપ કરાવવાનું રહેશે અને તેનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરના શીરે રહેશે.
- (૩૩) મ્યુનિ. કોર્પોરેશનના અધિકૃત અધિકારી કે કર્મચારી આ કામનું રોજીદુ સુપરવિઝન કરશે. જેમાં ઝોનલ ઓફિસર, સેનીટરી ઈન્સ્પેક્ટર, સેનીટરી સબ ઈન્સ્પેક્ટર, મુકાદમનો સમાવેશ થાય છે. તેમજ સમક્ષ સત્તા ધ્વારા નિયુક્ત કરેલ કોઈપણ પ્રતિનિધિ ધ્વારા આ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવશે.
- (૩૪) કોન્ટ્રાક્ટરશ્રીની તમામ કામગીરી પર લગત એસ.એસ.આઈ / એસ.આઈ / ઝોનલ ઓફિસર તેમજ ઉપરી અધિકારીઓ તરફથી વખતો વખત આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
- (૩૫) કોન્ટ્રાક્ટરે સફાઈ કામગીરી માટે પુરતી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે અને સતત સુપરવિઝન કરવાનું રહેશે. તેમજ એસ.એસ.આઈ. ની સુચના મુજબની કામગીરી ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ કરવાની રહેશે. તેમજ ઉડતો કચરો/પ્લાસ્ટિક સફાઈ કામગીરીના સમયગાળા દરમ્યાન સતત વીણવાનું રહેશે.
- (૩૬) આ કામ અંગે કોઈપણ જાતના વિવાદ-તકરાર, લીટીગેશન ઉપસ્થિત થશે તો કમિશનરશ્રીનો નિર્ણય આખરી અને છેવટનો રહેશે. તેમજ કોન્ટ્રાક્ટમાંથી ઉપસ્થિત થતા તમામ દાવાઓ જામનગર કોર્ટના સત્તાધિકારને આધિન રહેશે. તેમાં થનાર નાણાકીય ભારણની જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે.
- (૩૭) કોન્ટ્રાક્ટરે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. તેમજ ભાવો ભરતી વખતે જી.એસ.ટી. ધ્યાને રાખી ભાવો ભરવાના રહેશે. ભરેલ ભાવો મુજબ જે તે વખતના પ્રવર્તમાન જી.એસ.ટી. દરોનું કેલ્ક્યુલેશન કરી કોન્ટ્રાક્ટરે બીલ રજુ કરવાનું રહેશે.

(૩૮) કોઈપણ ટેન્ડર મંજૂર કે નામંજૂર કરવું તેના તમામ હકક જામનગર મહાનગરપાલિકાની સક્ષમ સત્તા અબાધિત રાખે છે. તેમજ મહાનગરપાલિકાના હિતમાં ટેન્ડરની શરતોમાં કોઈપણ વધારો કે ઘટાડો કરવાની સત્તા સમક્ષ સત્તા અબાધિત રાખે છે.

(૩૯) ટેન્ડર ભરવા માટેની લાયકાત :

ક્રમ	વિગત	અમલવારી
૧	સંસ્થાનું નોંધણી કરાયેલ રજીસ્ટ્રેશન	નકલ રજુ કરવી.
૨	શ્રેણી (કલાસ-બી તથા ઉપરના)	નકલ રજુ કરવી.
૩	પાન કાર્ડ	નકલ રજુ કરવી.
૪	જી.એસ.ટી સર્ટીફિકેટ (છેલ્લા ૬ માસના ભરેલ)	નકલ રજુ કરવી.
૫	ઈ.પી.એફ. અને ઈ.એસ.આઈ.સી. રજીસ્ટ્રેશન (૬ માસના ભરેલ)	નકલ રજુ કરવી.
૬	લેબર લાયસન્સ (મીનીમમ ૧૦૦ લેબરનું હોવું જરૂરી)	નકલ રજુ કરવી.
૭	બેંક સોલવંશી (રૂ.૫૯ લાખ)	નકલ રજુ કરવી.
૮	પ્રોફેશનલ ટેક્ષ ભરપાઈ કર્યાના આધાર (વર્ષ ૨૦૨૬)	નકલ રજુ કરવી.
૯	નોન બ્લેક લીસ્ટના આધાર (૩૦૦ સ્ટેમ્પ પર સોગંદનામું)	નકલ રજુ કરવી.
૧૦	છેલ્લા પાંચ વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર (૩૦% લેખે રૂ.૨૮.૫૦ લાખ) વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ નું સી. એ. સર્ટીફિકેટ	નકલ રજુ કરવી.
૧૧	છેલ્લા ૬ માસના ઈ.પી.એફ. અને ઈ.એસ.આઈ.સી. ભરપાઈ કર્યાના ચલણ રજુ કરવા. (છેલ્લા ૬ માસના ભરેલ)	આધારા સામેલ રાખવા.
૧૨	<b>A) હાઉસ કીપીંગ (સફાઈ) કામગીરીના કામમાં છેલ્લા ૫ વર્ષમાં.....</b> (૧) હાઉસ કીપીંગ (સફાઈ) કામગીરીના ટેન્ડર કોસ્ટના ૪૦% (રૂ.૮૯.૮૦ લાખ) ના ત્રણ કામો પૂર્ણ કર્યાના અનુભવના આધાર અથવા (૨) હાઉસ કીપીંગ (સફાઈ) કામગીરીના ટેન્ડર કોસ્ટના ૫૦% (રૂ.૧૧૨.૩૭ લાખ) ના બે કામો પૂર્ણ કર્યાના અનુભવના આધાર અથવા (૩) હાઉસ કીપીંગ (સફાઈ) કામગીરીના ટેન્ડર કોસ્ટના ૮૦% (રૂ.૧૭૯.૮૦ લાખ) ના સીંગલ કામો પૂર્ણ કર્યાના અનુભવના આધાર <b>B) સિવિલ કામગીરીના કામમાં છેલ્લા ૫ વર્ષમાં.....</b> (૧) સિવિલ કામગીરીના ટેન્ડર કોસ્ટના ૪૦% રૂ.૧૪.૦ લાખના ત્રણ કામો પૂર્ણ કર્યાના અનુભવના આધાર અથવા (૨) સિવિલ કામના કામગીરીના ટેન્ડર કોસ્ટના ૫૦% (રૂ.૧૭.૫૦ લાખ) ના બે કામો પૂર્ણ કર્યાના અનુભવના આધાર અથવા (૩) સિવિલ કામના કામગીરીના ટેન્ડર કોસ્ટના ૮૦% (રૂ.૨૮.૦ લાખ) ના સીંગલ કામો પૂર્ણ કર્યાના અનુભવના આધાર	સરકારી કચેરીઓ / મહાનગરપાલિકાનો અનુભવ હોવા જોઈએ.  વર્ક ઓર્ડર અને ફોર્મ-૩/એ અથવા કમ્પ્લીશન સર્ટીફિકેટની હાઈ કોપીની નકલ સામેલ રાખવી.
૧૨	ISO સર્ટીફિકેટ છેલ્લા પાંચ વર્ષનું રજુ કરવાનું રહેશે.	નકલ રજુ કરવી.

(૪૦) ટેન્ડર ડીસ્ક્વોલીફિકેશન કાઈટેરીયા :

- ૧) ઉપરોક્ત ટેન્ડર શરત નં.૩૯ અન્વયે માંગવામાં આવેલ, ટેન્ડર લાયકાતના આધારો / ડોક્યુમેન્ટ્સ / ટેન્ડર કોપી સેલ્ફ એટેસ્ટેડ કર્યા સાથે રજુ કરવાની રહેશે. અન્યથા ટેન્ડર રદ થવાને પાત્ર રહેશે.
- ૨) માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ્સના આધારોમાં ધોરણસરની લાયકાત ધરાવતા ન હોય તેવા બીડરનું ટેન્ડર રદ થવાને પાત્ર રહેશે.
- ૩) ફીઝીકલ ડોક્યુમેન્ટ્સ તપાસતા, રદ થયેલ ટેન્ડર બીડરની ઓન લાઈન ઓફર ખોલવામાં આવશે નહીં.
- ૪) માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ / કુરીયર મારફત નિયત સમય મર્યાદામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં પહોંચતા કરવાના રહેશે.

**(જા) પેનલ્ટી ની વિગત :**

લોકેશન દીઠ હાઉસ કીપીંગ સફાઈ કરવામાં આવેલ ન હોય	રૂ.૧૦૦૦/- પ્રતિ લોકેશન/પ્રતિ દિન
ફ્લોરની સફાઈ કરવામાં આવેલ ન હોય તો	રૂ.૫૦૦/- પ્રતિ દિન
ટોયલેટ બ્લોકની સફાઈ કરવામાં આવેલ ન હોય તો	રૂ.૫૦૦/- પ્રતિ દિન
લોકેશન વાઈઝ રાખવા મીનીમમ લેબર રાખવામાં આવેલ ન હોય તો	રૂ.૫૦૦/- પ્રતિ લેબર
સફાઈ કરેલ ગાર્બેજ કચરાપેટી સિવાયના અન્ય સ્થળે ઠાલવવામાં આવે હોય તો	રૂ.૧૦૦/- પ્રતિ દિન
યુનિફોર્મ પહેરવામાં આવેલ ન હોય તો	રૂ.૧૦૦/- પ્રતિ વ્યક્તિ
આઈ.ડી. કાર્ડ લગાવવામાં આવેલ ન હોય તો	રૂ.૫૦/- પ્રતિ વ્યક્તિ
સલામતિના સાધનો/ જરૂરીયાત મુજબ સફાઈ સાધનો ન હોય તો	રૂ.૧૦૦/- પ્રતિ દિન
સુપરવાઈઝર રાખવામાં આવેલ ન હોય તો	રૂ.૫૦૦/- પ્રતિ સુપરવાઈઝર

**પેમેન્ટની ટર્મ્સ એન્ડ કન્ડીશન :**

આ કામના ભાવો વાર્ષિક છે, બીલનું પેમેન્ટ બે માસ અથવા અનિવાર્ય સંજોગોમાં મ.ન.પા.ની કન્ડીશન મુજબ નિયમ અનુસાર કરવામાં આવશે. તેમજ પેનલ્ટી બાદ કરીને પેમેન્ટ ચુકવવામાં આવશે. જો અવાર નવાર કામમાં પેનલ્ટી બીલના ૧૦% કરતા વધુ થશે તો કોન્ટ્રાક્ટ ટર્મીનેટ અને બ્લેક લીસ્ટ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

**(B) મશીનરી કામ માટેની શરતો :**

- (૧) મ્યુનિ. કોર્પોરેશનના અલગ અલગ કામગીરીઓ જેવી કે દૈનિક ધોરણે વોર્ડ વિસ્તારની કામગીરી, રૂટીન સફાઈ કામગીરી, હાઈવે સફાઈ કામગીરી, બાયપાસ રોડ સફાઈ કામગીરી, ઓપન / કવર્ડ કેનાલ, નાલા-પુલિયા વિગેરેની સફાઈ માટે ડોઝર, ટ્રેક્ટર ટ્રોલી, ડમ્પર તથા એક્સકેવેટર જરૂરીયાત મુજબ સપ્લાય કરવાના રહેશે.
- (૨) કોન્ટ્રાક્ટર તરફથી કામે રાખવામાં આવેલ વાહન (ફ્યુલ સાથે), કર્મચારી, ડ્રાઈવર, મજૂર તથા વીમા સહિતની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. વાહનના તમામ પેપર્સ, આર.સી. બુક, વિમા પોલીસી વિગેરે તેમજ ડ્રાઈવરના ડ્રાઈવીંગ લાયસન્સ વિગેરે કોન્ટ્રાક્ટરશ્રીએ શાખા ધ્વારા જરૂરીયાતના કિસ્સામાં જો માંગવામાં આવે તો રજૂ કરવાના રહેશે. તેમજ સરકારશ્રીના લેબર-લો ની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે.
- (૩) આ કામ માટે જરૂરીયાત મુજબના તમામ વાહનો/મશીન પુરા પાડવાના રહેશે. જેમાં ભાવો ભરનાર પાર્ટીએ પોતાની માલિકી સિવાયના અન્ય માલિકીના મશીન કે વાહનો પણ મેળવીને પુરા પાડવાની જવાબદારી રહેશે અને તે માટેના જે તે મશીન અને વાહનના આર.ટી.ઓ. તથા વિમાને લગત તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે. જરૂરીયાત મુજબના વાહનો પુરા પાડવામાં નિષ્ફળ જાય ત્યારે જામનગર મહાનગરપાલિકા ધ્વારા ઘટતા મશીન / વાહનો ઓપન માર્કેટમાંથી પ્રવર્તમાન દરે ભાડે મેળવી આ કામ માટે મંજૂર થયેલા દર / ભાવથી જે દર / ભાવ વધુ ચુકવવો પડે તે તફાવતની રકમ કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે ગણી ચુકવવા પાત્ર બિલમાંથી અથવા ડીપોઝીટમાંથી વસુલ લેવામાં આવશે.
- (૪) ઉક્ત કામ દરમિયાન કોઈપણ અકસ્માત કે જાનહાનિ જેવા અનિચ્છનીય બનાવ કે કાયદાકીય બાબત ઉભી થાય તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઠેકેદારની રહેશે. આવા બનાવો અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના શાખા અધિકારીશ્રી, જામનગર મહાનગરપાલિકા, જામનગરને ત્વરિત લેખિત જાણ કરવાની રહેશે. ઉક્ત બાબતે મહાનગરપાલિકાની કોઈ જવાબદારી ગણાશે નહીં.

- (૫) કોન્ટ્રાક્ટરે ડોઝર, ડમ્પર, એક્સકેવેટર તથા ટ્રેક્ટર ટ્રોલી દૈનિક ધોરણેની જરૂરીયાત મુજબ સપ્લાય કરવાના રહેશે.
- (૬) વાહનો દિવસ અથવા રાત્રી દરમ્યાન કામની જરૂરીયાત પ્રમાણે વાહનો સપ્લાય કરવાના રહેશે.
- (૭) કોન્ટ્રાક્ટરે બેકહો લોડર, ડમ્પર, એક્સકેવેટર (હીતાચી) તથા ટ્રેક્ટર ટ્રોલીના ડ્રાઈવરો, ડીઝલ-ઓઈલ ટેક્ષીસ તથા અન્ય તમામ ખર્ચ સહિતના ભાવ આપવાના રહેશે. જે ધ્યાને લઈ ડ્રાઈવરો, ટેક્ષીસ તથા અન્ય તમામ ખર્ચ સહિતના ભાવ આપવાના રહેશે. તેમજ ભાવ મંજૂર થયે કોન્ટ્રાક્ટરશ્રીએ કામના ૫% લેખે સિક્યુરીટી ડીપોઝીટ તથા ૫% પર્ફોમન્સ બોન્ડ રજુ કરી, ધોરણસર એગ્રીમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કોન્ટ્રાક્ટરે વર્ક ઓર્ડર મળ્યે તાત્કાલિક કામગીરી કરવાની રહેશે.
- (૮) કામગીરી અધુરી છોડવાના કિસ્સામાં કે અત્રેના સુચન મુજબ કામગીરી ન થયાના કિસ્સામાં બાકી રહેતી કામગીરી કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે જામનગર મહાનગરપાલિકા ધ્વારા માર્કેટ રેઈટ મુજબ કરાવવામાં આવશે અને જે અંગે થનાર ખર્ચ તથા ૧૦% વહીવટી ચાર્જ વસુલી કોન્ટ્રાક્ટરના બીલમાંથી કપાત કરવામાં આવશે.
- (૯) આ કામમાં સુચવ્યા મુજબના વાહનો સમયમર્યાદામાં સપ્લાય કરવામાં નિષ્ફળ જશે તો ઠેકેદારના ખર્ચે અને જોખમે આ કામ મહાનગરપાલિકાને યોગ્ય લાગે તે કોન્ટ્રાક્ટર પાસે પૂર્ણ કરાવવામાં આવશે. અને આ કામ અંગે કોન્ટ્રાક્ટરની સિક્યોરીટી ડીપોઝીટ જપ્ત કરી, જામનગર મહાનગરપાલિકાના અન્ય કામો માટે પણ કોન્ટ્રાક્ટરને ગેરલાયક ઠરાવવામાં આવશે. તેમજ સક્ષમ સત્તાનો નિર્ણય આખરી ગણાશે.
- (૧૦) કામગીરી દરમ્યાન નિકળતો કચરો/કેરણ કોન્ટ્રાક્ટરે પોતાના વાહનથી નિયત ડમ્પીંગ સાઈટ અથવા ઈન્ચાર્જ સુચવે તે જગ્યાએ સ્વખર્ચે અનલોડ કરી અંતિમ નિકાલ કરવાનો રહેશે. આ કામગીરીનો પેટા કોન્ટ્રાક્ટ આપી શકાશે નહીં.
- (૧૧) કોઈપણ ભાવો સ્વીકારવા કે અસ્વીકારવા તેમજ મંજૂર કે નામંજૂર કરવા અંગેની સંપૂર્ણ સત્તા જામનગર મહાનગરપાલિકાની સક્ષમ સત્તા અબાધિત રાખે છે.
- (૧૨) આ કામ અંગે કોઈપણ જાતના વિવાદ-તકરાર, લીટીગેશન ઉપસ્થિત થશે તો કમિશનરશ્રીનો નિર્ણય આખરી અને છેવટનો રહેશે. તેમજ કોન્ટ્રાક્ટમાંથી ઉપસ્થિત થતા તમામ દાવાઓ જામનગર કોર્ટના સત્તાધિકારને આધિન રહેશે. તેમાં થનાર નાણાકીય ભારણની જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે.
- (૧૩) કોઈપણ ટેન્ડર મંજૂર કે નામંજૂર કરવું તેના તમામ હકક જામનગર મહાનગરપાલિકાની સક્ષમ સત્તા અબાધિત રાખે છે. તેમજ મહાનગરપાલિકાના હિતમાં ટેન્ડરની શરતોમાં કોઈપણ વધારો કે ઘટાડો કરવાની સત્તા સમક્ષ સત્તા અબાધિત રાખે છે.
- (૧૪) શરતી ટેન્ડરો માન્ય રાખવામાં આવશે નહીં. કોઈપણ ટેન્ડરનો સ્વીકારવું કે ન સ્વીકારવું તેનો આખરી નિર્ણય સક્ષમ ઓથોરીટી અબાધિત રાખે છે.
- (૧૫) જરૂર જણાયે અગાઉથી કોન્ટ્રાક્ટરને કંટ્રોલીંગ ઓફિસરશ્રી, નાયબ ઈજનેરશ્રી, લગત ઈજનેરશ્રી, ઝોનલ ઓફિસરશ્રી, એસ.આઈ.શ્રી તથા એસ.એસ.આઈ.શ્રી સુચવે તે મુજબ જરૂરીયાતની વાહનો/મશીનરી માટે જાણ કર્યેથી, કોન્ટ્રાક્ટરે જરૂરી વાહનો/મશીનરી સપ્લાય કરવાની રહેશે.

- (૧૬) આ રેઈટ કોન્ટ્રાક્ટ ટેન્ડર હાલે ૧ (એક) વર્ષ માટેના સમયગાળા માટે કરવામાં આવે છે. પરંતુ મ.ન.પા. ને યોગ્ય જણાય તો વધુ ૩ (ત્રણ) માસ માટે તેને લંબાવી શકશે. કોન્ટ્રાક્ટરે આ બાબત ધ્યાને લઈને ભાવ ભરવાના રહેશે.
- (૧૮) કામગીરી સ્થળો અને ભૌગોલિક સ્થળ સ્થિતિ અનુસાર કરવાની રહેશે. જરૂરી તમામ વ્યવસ્થા તથા સલામતિના પુરતી વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે કરવાની રહેશે.
- (૧૯) રોજબરોજના કામ ઉપર અનુભવી માણસો અને સુપરવાઈઝરી સ્ટાફ રાખવાનો રહેશે તથા ડમ્પર સપ્લાયનું પેમેન્ટ પર પ્રતિ ટ્રીપ લેખે કરવામાં આવશે. જેથી દરેક ટ્રીપની ગણતરી માટે જરૂરી જણાય ત્યારે ઈન્ચાર્જ સુચવે તે વે-બ્રીજ ખાતે દરેક ટ્રીપનું વજન કરાવવાનું રહેશે અને બીલ વખતે તેની સ્લીપ રજુ કરવાની રહેશે.
- (૨૦) કામ કરવાની સુચના મળતા જે તે સમય મર્યાદા નક્કી થાય તે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનું રહેશે. નિષ્ફળ ગયે પ્રતિદિન રૂ.૧૦૦૦/- પેનલ્ટી કરવામાં આવશે.
- (૨૧) ટેન્ડરોની અલગ અલગ પ્રકારની શરતોની અમલવારીના ડીફોલ્ટના કિસ્સામાં કોન્ટ્રાક્ટરના રનીંગ બીલમાંથી મહત્તમ ૧૦% ની મર્યાદામાં સક્ષમ ઓથોરીટી દ્વારા જે પણ પેનલ્ટી વસુલવા નિર્ણય કરવામાં આવે તે કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે અને આ અંગે કોઈપણ પ્રકારનો વાદ વિવાદ કે લીટીગેશન ઉપસ્થિત કરવાનું રહેશે નહીં.
- (૨૨) કોન્ટ્રાક્ટરે ફાળવેલ વાહનો જે તે વોર્ડ / સાઈટ પર પહોંચી તેના દ્વારા કામગીરી શરૂ કર્યાથી સમય ગણવાનો રહેશે. ટ્રાવેલીંગ પીરીયડ ધ્યાનમાં લેવાનો રહેશે નહીં.
- (૨૩) લોએસ્ટ પાર્ટી નક્કી થઈ આવ્યે જે તે દિવસથી લોએસ્ટ પાર્ટીએ ધોરણસરના કરારખત (એગ્રીમેન્ટ) અંદાજીત કોન્ટ્રાક્ટ વેલ્યુના ૫% લેખે સિક્યુરીટી ડીપોઝીટ તથા ૫% પર્ફોમન્સ બોન્ડ રકમ જમા કરાવ્યા સહિતની કાર્યવાહી દિન-૩૦ માં બિનચૂક પૂર્ણ કરવાની રહેશે. જેના ડીફોલ્ટના કિસ્સામાં ઈ.એમ.ડી જપ્ત કરી જે તે કોન્ટ્રાક્ટરને જામનગર મહાનગરપાલિકાના કોઈપણ કોન્ટ્રાક્ટ વર્ક કે કામગીરી માટે ૩ વર્ષ સુધી ડિસ્ક્વોલીફાઈ કરી "કાળી યાદી" માં મુકવામાં આવશે.
- (૨૪) કામગીરી દરમ્યાન કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલ કામદારોને ગમબૂટ, હેન્ડ ગ્લોઝ, માસ્ક વિગેરે સલામતિના સાધનો પુરા પાડવાના રહેશે.
- (૨૫) કોન્ટ્રાક્ટરે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે. તેમજ ભાવો ભરતી વખતે જી.એસ.ટી. ધ્યાને રાખી ભાવો ભરવાના રહેશે. ભરેલ ભાવો મુજબ જે તે વખતના પ્રવર્તમાન જી.એસ.ટી. દરોનું રીવર્સ કેલ્ક્યુલેશન કરી, કોન્ટ્રાક્ટરે ઈન્વોઈશ બીલ રજુ કરવાનું રહેશે.
- (૨૬) આ કામ માટે જરૂરીયાત મુજબના મહત્તમ સંખ્યામાં મશીન કે વાહનો પુરા પાડવાના થાય. તેવા કિસ્સામાં લોએસ્ટ ભાવો ભરનાર પાર્ટીએ પોતાની માલિકી સિવાયના અન્ય મશીન કે વાહનો પણ અન્ય પાસેથી મેળવીને પુરા પાડવાની જવાબદારી રહેશે અને તે માટેના જે તે મશીન અને વાહનના આર.ટી.ઓ. તથા વિમાને લગત તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે. જરૂરીયાત મુજબના વાહનો પુરા પાડવામાં નિષ્ફળ જાય ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘટતા મશીન / વાહનો ઓપન માર્કેટમાંથી પ્રવર્તમાન દરે ભાડે મેળવી આ કામ માટે મંજૂર થયેલા દર / ભાવથી જે દર / ભાવ વધુ ચુકવવો પડે તે તફાવતની રકમ કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે ગણી ચુકવવા પાત્ર બિલમાંથી અથવા ડીપોઝીટમાંથી વસુલ લેવામાં આવશે.

(C) સિવિલ વર્ક માટેની શરતો :

- (૧) કામ શરૂ કરતા પહેલા કામની સાઈટ પર પડેલ કચરો, દબાણ કે અન્ય નડતરરૂપ વસ્તુઓ કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે દૂર કરી કામ થઈ શકે તે રીતે સાઈટ ચોખ્ખી કરવાની રહેશે. જેના કોઈ અલગ ભાવ આપવામાં આવશે નહિં.
- (૨) કામની સાઈટ પર આજુબાજુના વિસ્તારમાં ગંદુ વપરાશ પાણી કે ગટરના નિકાલનું પાણી નડતરરૂપ હોય તો કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે સ્વખર્ચે કામની સાઈટને અનુરૂપ દૂર કરવાનું રહેશે.
- (૩) કામ શરૂ કર્યા બાદ સાઈટ પર ખોદાણનો સ્ટફ અન્ય વેસ્ટેજ મટીરીયલ્સ જે કાંઈ વધારાનું બીન ઉપયોગી હોય તે તમામ વેસ્ટેજ મટીરીયલ એન્જીનીયર ઈન્ચાર્જ બતાવે ત્યાં નાખી પાથરી આપવાનું રહેશે.
- (૪) ચાલુ કામે ખોદાણ દરમ્યાન પાણીની પાઈપ લાઈન, ગટર લાઈન, જો નડતરરૂપ હોય તો કોન્ટ્રાક્ટરે ખાતાની સુચના અનુસાર ફેરવી આપવાની રહેશે. જેનું ચુકવણું એજન્સીના મંજૂર થયેલ ભાવથી કરી આપવાનું રહેશે.
- (૫) ચાલુ કામ દરમ્યાન કામ શરૂ કરતા સમયે ટેલીફોન વાયર કેબલ કે ઇલેક્ટ્રીક લાઈનના વાયર / કેબલ નડતરરૂપ હોય તો જે તે ખાતાની ધ્યાને મુકી નુકશાન થાય નહીં તે રીતે કરવાનું રહેશે.
- (૬) ચાલુ કામે સાઈટ પર ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે માલસામાન રાખવાનો રહેશે. દિવસ અને રાત્રીના સમયે ટ્રાફીક સાઈન વિ. રાખવાના રહેશે.
- (૭) ચાલુ કામે સાઈટ પર કોઈપણ મુશ્કેલી ઉભી થાય કે અડચણ ઉભી થાય તો તેની નિકાલ કોન્ટ્રાક્ટરે પોતે ઈન્ચાર્જ એન્જીનીયરની સલાહ સુચના મુજબ સ્વખર્ચે કરવાનું રહેશે.
- (૮) સાઈટની આસપાસની મિલકતોને કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તે મુજબ કોન્ટ્રાક્ટરને કામ કરવાનું રહેશે. આમ છતાં જો કોઈ મિલકતોને નુકશાન થશે તો ઠેકેદારશ્રીએ પોતાના સ્વખર્ચે અને જોખમે રીપેર કરી આપવાનું રહેશે.
- (૯) સાઈટ ઉપરના નડતર રૂપ બાવળો, ઝાંડી ઝાંખરા વિગેરે ઠેકેદારશ્રીએ પોતાના સ્વખર્ચે દૂર કરવાના રહેશે.
- (૧૦) કોન્ટ્રાક્ટરે કામ ટેન્ડરની શરતો અને સ્પેશીફિકેશન મુજબ જ કરવાનું છે. કોઈપણ સંજોગોમાં સ્પેશીફિકેશન વિરૂધ્ધ કોઈપણ વ્યક્તિ કહે તો પણ કરવાનું નથી અને ચાલુ કામે કામ થઈ ગયા બાદ કામની ગુણવત્તા ટેસ્ટીંગ કરાવતા નબળી માલુમ પડશે તો કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે ફરીથી કરી આપવાની રહેશે. અને આ અંગેની તમામ નાણાંકીય તથા ગુણવત્તા અંગેની સઘળી જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
- (૧૧) ચાલુ કામ દરમ્યાન કેનાલ / ગટરની અંદર ખોદાણ કામનો સ્ટફ ન પડે તે તકેદારી કોન્ટ્રાક્ટરે રાખવાની રહેશે. તેમ છતાં જરૂરત ઉભી થયે કોન્ટ્રાક્ટરે પોતાના કર્મચારી મારફત આખી કેનાલ / ગટર સાફ કરાવી આપવાની રહેશે જેનું કોઈ અલગથી પેમેન્ટ આપવામાં આવશે નહીં.
- (૧૨) કોંક્રીટીંગ કર્યા બાદ નિયમઅનુસાર ગત્રી બેગથી અથવા સીમેન્ટ મોર્ટારથી કચારા કરી તેનું કચોરીંગ કરવાનું રહેશે. જેનું અલગથી પેમેન્ટ આપવામાં આવશે નહીં.

- (૧૩) ખાતા દ્વારા જણાવ્યેથી આ ટેન્ડરમાંથી ઠેકેદારે ચરેડાઓનું કોંક્રીટીંગ, કચરાની કુંડીઓ, ડંકીનાં ફાઉન્ડેશન વિગેરે ઉપરાંત જે કાંઈ અન્ય કામ દર્શાવવામાં આવે તે તમામ કામ આ ટેન્ડરમાંથી તેનાં મંજૂર થયેલ ભાવોએ કરી આપવાનું રહેશે.
- (૧૪) જે – તે ટેન્ડર ભરનાર અને મંજૂર થનાર એજન્સીએ પોતે જ કામ કરવાનું રહેશે અને તેઓ પેટા કોન્ટ્રાક્ટ / સબલેટથી કામ કરાવી શકશે નહીં.
- (૧૫) આ કામમાં વપરાતાં ગૌણ ખનીજની રોયલ્ટી વિ. ભરી તેનું કલીયરન્સ સર્ટીફિકેટ મેળવવાનું રહેશે.
- (૧૬) નિયમ અનુસાર લેબર લાયસન્સ ફરજીયાત રજુ કરવાનું રહેશે.
- (૧૭) ટેન્ડર પ્રક્રિયા બાદ એગ્રીમેન્ટ સમયે ટેન્ડરના અંદાજીત ખર્ચના વખતો વખતના સરકારશ્રીના નિયમોનુસાર પરફોર્મન્સ બોન્ડની રકમ એફ.ડી.આર. અથવા બેંક ગેરંટી સ્વરૂપે ફરજીયાત જમા કરાવવાની રહેશે.
- (૧૮) કોઈપણ કામમાં ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ઈ.એમ.ડી.ની રકમ માટે કોઈપણ સંજોગોમાં મુકિત પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં
- (૧૯) લોખંડ / સીમેન્ટ ના અસલ બિલો રજુ કરવાના રહેશે અથવા અસલ બિલો સીટી એન્જિનીયર / નાયબ ઈજનેર પાસે રજુ કરી એટેસ્ટેડ / વેરીફાઈ કરાવવામાં આવશે તો તેના તેવા ઝેરોક્ષ બિલો માન્ય રાખવામાં આવશે.
- (૨૦) ખાણ – ખનીજ ખાતાનું નો-ડયુ સર્ટીફિકેટ ફરજીયાત રજુ કરવાનું રહેશે અને સીક્યોરીટી ડીપોઝીટ પુર્વજનો ફી મેઈનટેનન્સ ગેરંટી પીરીયડ પુર્ણ થયા બાદ છુટી કરવામાં આવશે.
- (૨૧) આ કામના વાપરવાની થતી સીમેન્ટ ઠેકેદારે પોતે ઓપન મોર્કેટમાંથી લાવીને વાપરવાની રહેશે. આ માટે મહાનગરપાલિકાએ મંજૂર કરેલ (૧) અંબુજા, (૨) કમળ, (૩) સિધ્ધિ, (૪) હાથી, (૫) એલ. એન્ડ ટી. (અલ્ટ્રાટેક સીમેન્ટ) તથા (૬) એ. સી. સી. (૭) સાંધી સીમેન્ટ, (૮) હાઈબોન્ડ સીમેન્ટ એમ કુલ ૮ (આઠ) બ્રાન્ડ પૈકી ગમે તે એક બ્રાન્ડની ઓ.પી.સી. ૫૩ ગ્રેડ સીમેન્ટ વાપરવાની રહેશે. આ અંગેનો પાકા બીલ્સ ઠેકેદારે રજુ કરવાના રહેશે. અને સીમેન્ટ વપરાશના દર ૫૦ મેટ્રીક ટન ગુણાંકમાં અથવા તેનાથી ઓછા જથ્થા માટે સરકાર માન્ય લેબોરેટરીમાં ઠેકેદારે પોતાના ખર્ચે સિમેન્ટનું ટેસ્ટીંગ કરવાનું રહેશે.
- (૨૨) દરેક કોન્ટ્રાક્ટરે ઈ.પી.એફ. નંબર ફરજીયાત રજુ કરવાનો રહેશે. અન્યથા ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે.
- (૨૩) આ કામ માટે મોસ્ટ સ્પેશીફીકેશન મુજબ ઈકવીપમેન્ટની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે કરી આ કામ કરાવવાનું રહેશે. તે માટે અલગથી કોઈ ચાર્જ કે વધારાનું પેમેન્ટ આપવામાં આવશે નહીં.
- (૨૪) કામ ફક્ત દિવસ દરમિયાન કરવાનું રહેશે ખાસ સંજોગોમાં લેખિત મંજૂરી મેળવીને રાત્રીના શક્ય હશે તો કામ કરવા દેવામાં આવશે.
- (૨૫) આ કામે બિલ્ડીંગ મટીરીયલ્સમાં કે લેબર ચાર્જીસમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો / ભાવ તફાવત આપવામાં આવશે નહીં જેની સ્પષ્ટ નોંધ લેવી
- (૨૬) કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી મિલકત અથવા જામનગર મહાનગરપાલિકાની સ્થાવર અથવા તો જંગમ મિલકતને નુકશાન થશે તો કોન્ટ્રાક્ટરશ્રીએ સ્વખર્ચે કામ કરી આપવાનું રહેશે. જેનું અલગથી કોઈ વળતર મળશે નહીં.

- (૨૭) આ કામ પૈકી ટેન્ડર શેડ્યુલ-સિવાયની કોઈપણ આઈટમ કરવાની થાય કે આ આઈટમ એસ.ઓ.આર.માં સમાવિષ્ટ થતી હોય તો કોન્ટ્રાક્ટરે તેઓના મંજૂર થયેલ ભાવે કરી આપવાની રહેશે.
- (૨૮) સરકારશ્રી દ્વારા બાંધકામ અંગેના (પી.ડબલ્યુ.ડી. ખાતા દ્વારા) ભવિષ્યમાં વખતા વખતના છેલ્લાં સુધારા તેમજ શરતો તેમજ કોન્ટ્રાક્ટરના કામ અંગેના ગાઈડ લાઈનો, પરિપત્ર જે કાંઈ બહાર પાડવામાં આવશે તે કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે. જે ધ્યાને રાખીને કોન્ટ્રાક્ટર ધ્વારા આ ટેન્ડર ભરવાનું રહે છે અને એ તમામ સરકારશ્રીના સુધારા વધારા પરિપત્ર વિગેરે કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે.
- (૨૯) ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટર મહાનગરપાલિકા સામે કોઈ લીટીગેશન / દાવો / કોર્ટ કેસ કરેલ હશે તો તે ટેન્ડર સાથે તેની વિગતો રજૂ કરવાની રહેશે અન્યથા આવી કોઈ વિગતો કોન્ટ્રાક્ટર દ્વારા છુપાવવામાં આવશે તો તેઓનું ટેન્ડર આપોઆપ રદ થશે. તેમજ તેનું ટેન્ડર ખોલવામાં આવશે નહીં.
- (૩૦) કામની અંદાજીત રકમ (Estimated Amount Put To The Tender) રૂ.૩૦.૦૦ લાખથી વધુ હશે તેવા કામો માટે એગ્રીમેન્ટ સમયે કામની અંદાજીત રકમનાં / વખતો વખતના સરકારશ્રીના પરિપત્ર મુજબ પરફોર્મન્સ બોન્ડની રકમ એફ.ડી.આર. અથવા બેંક ગેરંટી સ્વરૂપે જમા કરાવવાની રહેશે. એગ્રીમેન્ટ વખતે કામની ટેન્ડર રકમના ૫% લેખે સિક્યોરીટી ડીપોઝીટ ડી.ડી. સ્વરૂપે ભરપાઈ કરવાની રહેશે.
- (૩૧) ટેન્ડર અન્વયે જે અનામતની રકમ ફીક્સ ડીપોઝીટ, એન.એ.સી. યા અન્ય કોઈ બચત પત્રના માધ્યમથી અનામત મુકવામાં આવે તો તેટલી અનામતની રકમ ઉપર મુંબઈ સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની અનુ. (૧) ના આર્ટીકલ-૩૬ (ક) સાથે આર્ટીકલ-૨૦ (ક) મુજબ સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની થાય છે. હાલ આર્ટીકલ-૨૦ (ક) મુજબ રૂ.૧૦૦/- તથા તેના ભાગ દીઠ સરચાર્જ સાથે ૪.૯૦ % ડ્યુટી દર અમલી છે. આ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવે તે સમયે થતા કરારનામાં ઉપર ઉક્ત વિગતો નિયમોનુસારની યોગ્ય ડ્યુટી ભરપાઈ કરવાની રહે છે. આ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે.
- (૩૨) સરકારશ્રી દ્વારા બાંધકામ અંગેના (પી.ડબલ્યુ.ડી. ખાતા દ્વારા) ભવિષ્યમાં વખતા વખતના છેલ્લાં સુધારા તેમજ શરતો તેમજ કોન્ટ્રાક્ટરના કામ અંગેના ગાઈડ લાઈનો, પરિપત્ર જે કાંઈ બહાર પાડવામાં આવશે તે કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે. જે ધ્યાને રાખીને કોન્ટ્રાક્ટર ધ્વારા આ ટેન્ડર ભરવાનું રહે છે અને એ તમામ સરકારશ્રીના સુધારા વધારા પરિપત્ર વિગેરે કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે.
- (૩૩) ટેન્ડરની આઈટમમાં મટીરીયલ્સનો બેઝીક રેઈટ આપવામાં આવેલ છે. જેમાં કોન્ટ્રાક્ટરે મટીરીયલ્સ સપ્લાય, સ્પેડીંગ લીડ અને લીફ્ટ તથા કાર્ટીંગ સાથેનું કામ કરવાનું રહેશે તેમજ મટીરીયલ્સ સપ્લાય સ્પેડીંગ, લીડ અને લીફ્ટ તથા કાર્ટીંગ અલગથી ભાવ આપવામાં આવશે નહીં. જે ધ્યાને લઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડરમાં ભાવ ભરવાનાં રહેશે.
- (૩૪) સદરહું કામે સૌથી લોએસ્ટ આવેલ એજન્સીએ તેઓ ધ્વારા ભરવામાં આવેલ ભાવ અંગેનું રેઈટ એનાલીસીસ ટેન્ડર ખુલ્યા બાદ અત્રેથી લખવામાં આવેલ પત્ર મળ્યાની તારીખથી ૭ (સાત) દિવસમાં રજૂ કરવાનું રહેશે. અન્યથા તેઓનું ટેન્ડર રદ થવાને પાત્ર રહેશે. તેમજ તેઓ ધ્વારા ટેન્ડર સાથે ભરવામાં આવેલ ઈ.એમ.ડી. જપ્ત કરી પાર્ટીને જામનગર મહાનગરપાલિકાના તમામ કામો માટે ૦૩ (ત્રણ) વર્ષ માટે ડીબાર્ડ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
- (૩૫) જો કોઈ પાર્ટી ધ્વારા ઓનલાઈન ભાવો ભરી ટેન્ડર પ્રોસીજરમાં ભાગ લેવામાં આવે પરંતુ ત્યારબાદ ફીઝીકલ ડોક્યુમેન્ટ સબમીટ કરવામાં નિષ્ફળ ગયેથી આવી પાર્ટીને પણ જામનગર મહાનગરપાલિકાના તમામ કામો માટે ૦૩ વર્ષ માટે ડીબાર્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તથા ઈ.એમ.ડી. જપ્ત કરવામાં આવશે.

- (૩૬) હાલે આ કામ માટે સ્વચ્છ શહેર સુંદર શહેરની ગ્રાંટ મળશે તેમ ધારીને ટેન્ડરીંગ કરવામાં આવેલ છે. પરંતુ તે ગ્રાંટ ન મળે તો મ.ન.પા.ના અન્ય નાણાંકીય સ્ત્રોતમાંથી આ કામ કરવાનું રહેશે એમ સમજીને આ ટેન્ડર માટે કોન્ટ્રાક્ટરે ભાવ ભરવાનાં રહેશે.
- (૩૭) ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેર્જસ એન્ડ ધેયર રીહીબીલીટેશન એક્ટ-૨૦૧૩ એક્ટની ચૂસ્તપણે અમલવારી કરવાની રહેશે.
- (૩૮) ઈ.પી.એફ. કોમ્પ્લાયન્સ ફરજીયાત કરવાનું રહેશે.
- (૩૯) સદરહું કામ માટે મ.ન.પા. પોતાની અનુકુળતા અનુસાર પેમેન્ટ કરશે. સમયસર પેમેન્ટ ન મળી શકવાનું કારણ દર્શાવી કામનો પ્રોગ્રેસ ધીમો કે બંધ કરી શકાશે નહિ અન્યથા કોન્ટ્રાક્ટર ડી-બાર્ડ કરવા સુધીનાં પગલાં લેવામાં આવશે.
- (૪૦) ગુજરાત સરકારશ્રીના શ્રમ આયુક્તના કાયદાઓને ધ્યાને લઈ અને કોન્ટ્રાક્ટરના ભાવોમાં લઘુત્તમ વેતન ધારો તેમજ ઈ.પી.એફ.ઓ., કર્મચારી વીમા જેવા તમામ કાયદાનું પાલન કોન્ટ્રાક્ટરશ્રીએ કરવાનું રહેશે.
- (૪૧) માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકારના પરિપત્ર નં. ૫૨૪-૨૦૧૦-૧૭૧૩૨૨/(૨૧)/૩૧, તા.૧૮/૦૩/૨૦૧૦ અનુસાર ૧૫ % કરતાં વધુ નીચા ભાવો ભરી ઓફર આપવામાં આવશે તો ટેન્ડરની મુળ અંદાજીત રકમ અને ટેન્ડરની મંજૂર થયેલ રકમના તફાવતના ૫ % મુજબ વધારાની સીક્યોરીટી ડીપોઝીટ જમા કરાવવાની રહેશે. જે બાબત ધ્યાને લઈ એજન્સીએ ભાવો ભરવાના રહેશે.
- (૪૨) ૧૮% જી.એસ.ટી. અલગથી ચુકવવામાં આવશે.
- (૪૩) ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતા તમામ કોન્ટ્રાક્ટર/વેન્ડરે જનરલ બોર્ડ ઠરાવ નં.૬૯ 'એ.એચ.', તા.૧૯/૦૨/૨૦૨૨ મુજબ રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કરવાની રહેશે તેમજ ભરપાઈ કર્યા અંગેની પહોંચ અત્રે રજુ કરવાની રહેશે અથવા ભરપાઈ કરવાની બાકી હોય તેવા સંજોગોમાં ઠરાવમાં આપેલ વિગત મુજબ લાગુ પડતી રકમનો જામનગર મહાનગરપાલિકાના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ રજુ કરવાનો રહેશે. વખતો વખતના સુધારા - વધારા એજન્સીને બંધનકર્તા રહેશે. (ઠરાવની નકલ આ સાથે પાના નં.૮ પર સામેલ છે.)
- (૪૪) ટેન્ડર ડોક્યુમેન્ટ ફક્ત RPAD / SPEED POST/ COURIER થી જમા કરાવવાના રહેશે.
- (૪૫) ચાલુ કામ દરમિયાન નળની પાઈપલાઈન / ભુગર્ભ ગટર લાઈન / અન્ય કોઈપણ કનેક્શન તૂટે નહીં કે નુકશાન ન થાય તે રીતે સાવચેતીથી કામ કરવાનું રહેશે તેમ છતા જો કોઈ નુકશાન થશે તો ઠેકેદારએ સ્વખર્ચે રીપેર કરી આપવાનું રહેશે. જેનું કોઈ અલગથી ચુકવણું કરવામાં આવશે નહીં.
- (૪૬) આ કામ શેડ્યુલ "બી" સિવાય "એસ.ઓ.આર" ની અન્ય કોઈપણ આઈટમ કરવાની થાય તો તે આઈટમ કોન્ટ્રાક્ટરે તેઓના ભરેલ ભાવે કરી આપવાની રહેશે.
- (૪૭) આ કામનું કમ્પ્લીશન સર્ટીફિકેટ ઈશ્યુ કર્યાની તારીખથી ૫ (પાંચ) વર્ષનો ફ્રી મેઈન્ટેનન્સ ગેરંટી પીરીયડ કોન્ટ્રાક્ટરે આપવાનો રહેશે. આ સમયાગાળા દરમિયાન બિલ્ડીંગ વર્ક્સને કોઈપણ નુકશાન થાય તો એન્જિનીયર ઈન્ચાર્જની સુચના મુજબ તેનું સમારકામ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે અને જોખમે કરી આપવાનું રહેશે સીક્યોરીટી ડીપોઝીટ ફ્રી મેઈન્ટેનન્સ ગેરંટી માટે અનામત રાખવામાં આવશે. આ અનામત રાખેલ રકમ ગેરંટી પીરીયડ ૫ (પાંચ) વર્ષ પુર્ણ થયા બાદ રીલીઝ કરવામાં આવશે.
- (૪૮) આ કામ માટે સ્વખર્ચે સ્ટ્રક્ચરલ ડિઝાઈન રજીસ્ટર્ડ થયેલા સ્ટ્રક્ચર એન્જિનીયર પાસેથી બનાવવાની રહેશે અને જામનગર મહાનગરપાલિકાની સક્ષમ સત્તા પાસે રજુ કરી તે એપ્રુવ કરાવવાની રહેશે.

- (૪૯) સરકારશ્રીના ધોરણ મુજબ સીક્યોરીટી ડીપોઝીટ અને પરફોર્મન્સ બોન્ડ નિયમોનુસાર ભરવાના રહેશે.
- (૫૦) કોઈપણ ટેન્ડર મંજૂર કરવું કે ના-મંજૂર કરવું તેનો અધિકાર સક્ષમ સત્તાને અબાધીત રાખવામાં આવે છે.
- (૫૧) જનરલ બોર્ડ ઠરાવ નં. ૧૨૨ "એ" "એચ" (૧), તા.૧૯/૦૨/૨૦૨૦ મુજબ કેરણ ચાર્જ ની રકમ રૂ.૨૦ પ્રતિ ચો.મી. બિલમાંથી કપાત કરવામાં આવશે. જે રીફંડેબલ નથી જે ધ્યાને લઈ ભાવો ભરવાના રહેશે.
- (૫૨) **છેલ્લા પાંચ વર્ષના આઈ.ટી. રીટર્ન રજુ કરવાના રહેશે.**
- (૫૩) માર્કેટમાં મટીરીયલના ભાવફેર અંગે કોઈ અલગથી ચુકવણું કરવામાં આવશે નહીં
- (૫૪) કામની સમય મર્યાદામાં ૧૨ માસ ની રહેશે. જરૂર જણાયે કામગીરી વધુ ૩ માસ માટે લંબાવી શકાશે.
- (૫૫) ગ્રાંટ ઉપલબ્ધી અનુસાર વધુ / ઓછા પ્રમાણમાં કામગીરી કરવાની રહેશે.
- (૫૬) સદરહું કામમાં ડીમોલીશન દરમ્યાન / કન્સ્ટ્રક્શન દરમ્યાન કોઈપણ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. તેમ છતાં કોઈ અકસ્માત થાય તો તેની પુરેપુરી જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
- (૫૭) ISO સર્ટીફિકેટ છેલ્લા પાંચ વર્ષનું રજુ કરવાનું રહેશે.
- (૫૮) મીટર કનેક્શન કોન્ટ્રાક્ટરે કરાવવાનું થશે જેનું કોઈ અલગથી ચુકવણું કરવામાં આવશે નહીં.
- (૫૯) બુકલેટ મુજબ પેઈન્ટીંગ તથા સંલગ્ન કામ (ચિત્રકામ) કરી આપવાની આઈટમનો શેડ્યુલ "બી" માં સમાવેશ કરવામાં આવેલ છે જે મુજબની કામગીરી એજન્સીને કરી આપવાની રહેશે અને આ કામનું કોઈ અલગથી ચુકવણું કરવામાં આવશે નહીં. જે ધ્યાને રાખી એજન્સીએ ભાવો ભરવાના રહેશે.
- (૬૦) વોટર કનેક્શન (પાણીની લાઈન) નું કનેક્શન કોન્ટ્રાક્ટરે કરી આપવાનું રહેશે જેનું અલગથી કોઈ ચુકવણું કરવામાં આવશે નહીં.

#### ટર્મીનેશનની શરતો :

- જામનગર મહાનગરપાલિકા કોઈપણ સમયે કોન્ટ્રાક્ટરને નીચેની શરતોને આધીન નોટીસ આપી છુટા કરી શકશે.
- (૧) ટેન્ડરની કોઈ શરત/એગ્રીમેન્ટનો ભંગ કરવામાં આવશે.
- (૨) જો કોન્ટ્રાક્ટર બેંકરપ્ટ અથવા ઈન્સોલ્વન્ટ હોય,
- (૩) કોન્ટ્રાક્ટર ધ્વારા ટેન્ડરની શરતો મુજબ કામગીરીમાં સુધારો કરવામાં ન આવે તો મ.ન.પા. ધ્વારા કામગીરી બાબતે સાત દિનની સમય મર્યાદાની શો કોઝ નોટીસ આપીને ટેન્ડરની શરતો મુજબ સુચવેલ કામગીરીના પરફોર્મન્સમાં નિયત સમય મર્યાદામાં સુધારો ન થયેલ હોય,

તારીખ : \_\_\_\_\_

સ્થળ : \_\_\_\_\_

કોન્ટ્રાક્ટરની  
સહી તથા સિક્કો

કાર્યપાલક ઈજનેર  
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા  
જામનગર મહાનગરપાલિકા